

Head Office : Nilkamal House, 77/78, Road No. 13/14, M.I.D.C., Andheri (East), Mumbai - 400 093, INDIA. Tel. : (91-22) 4235 8888

Material Handling Division : Fax : (91-22) 2836 1923 ● E-mail : marketing@nilkamal.com ● Visit us at : www.nilkamalmaterialhandling.com

Furniture Division : Fax : (91-22) 2835 3556 ● E-mail : furniture@nilkamal.com ● Visit us at : www.nilkamal.com

@home Division : Fax : (91-22) 2837 2787 ● E-mail : connect@at-home.co.in ● Visit us at : www.at-home.co.in

Date: 19-06-2024

Ref: 38th AGM/BSE/NSE

To,
The Secretary
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers
Dalal Street, Mumbai-400 001.

The Secretary
National Stock Exchange of India Limited,
Exchange Plaza, 5th Floor, Plot No. C/1, G Block,
Bandra Kurla Complex, Bandra East, Mumbai-
400 051.

SCRIPT CODE : 523385

SYMBOL : NILKAMAL

Dear Sir,

Sub:- Newspaper Advertisement- Notice to Shareholders for 38th Annual General Meeting to be held on July 19, 2024.

Ref: Compliance under Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations").

Pursuant to Regulation 30 of Listing Regulations, we hereby enclose the copies of the Notice issued for attention of the Shareholders in respect of information regarding 38th Annual General Meeting scheduled to be held on Friday, July 19, 2024 through Video Conferencing / Other Audio Visual Means. The notice was published in Financial Express and Damanganga Times on today i.e. June 19, 2024.

This is for your information and record.

Thanking you,
Yours faithfully,
For Nilkamal Limited





Priti Dave
(Company Secretary)

Encl: a.a.

MARKFED
The Punjab State Cooperative Supply & Marketing Federation Limited
Markfed House, Plot Number-5, Sector 35-B, Chandigarh-160022
EPANX Numbers: 0172-2609170, 2605302, 2606095-07, 2606161-63
Fax Numbers: 0172-2609161, 2609471, 2609411, 2609487
Email: psm@markfedpunjab.com Visit us: www.markfedpunjab.com

E-Tender Notice
Reference no. Mfd/Mktg/SA-3/2024/294 Date: 18/6/2024
The Punjab State Cooperative Supply and Marketing Federation Limited (MARKFED) invites online bids for outsourcing of Vanaspati Ghee.
Closing Date & Time :- 10.07.2024 & 12:00 noon
Date of opening of Tender:- 10.07.2024 & 03:00 PM
For detail log on to: eproc.punjab.gov.in & www.markfedpunjab.com
Note: Any corrigendum/Addendum to the Tender Notice shall be published on the above website only.

**MANAGING DIRECTOR
MARKFED, CHANDIGARH**

AXIS BANK LTD.
Corporate Office, Axis House, Structured Assets Group, C-2, Media International Centre, Pandurang Budhkar Marg, Worli, Mumbai - 400025. Tel: +91 9920085385 www.axisbank.com (CIN: L65110GJ1993PLC020769)

POSSESSION NOTICE
[As per Appendix IV read with rule 8(1) of the Security Interest (Enforcement) Rules, 2002] Whereas,
The Authorised Officer of the Axis Bank Ltd., under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) (hereinafter referred to as "SARFAESI Act") and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 09.05.2022 calling upon the Borrower/Guarantors/Mortgagors viz. Satiati Engineering (I) Private Ltd., Sandeep Padmakar Chinchankar, Suchita Sandeep Chinchankar, Sanket Sandeep Chinchankar, Harihan Iyer, Nagalakshmi Iyer and Viswanathan Iyer to repay the amount mentioned in the notice being Rs.15,63,18,143/- (Rupees Fifteen Crore Sixty Three Lakh Eighteen Thousand One Hundred and Forty Three) being the amount due as on 30.04.2022 with further interest at contractual rate from 01.05.2022 till the date of actual payment, within a period of 60 days from the date of the notice.
The Borrower / Guarantors / Mortgagors having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantors / Mortgagors and the public in general that the Chief Metropolitan Magistrate at Esplanade, Mumbai in exercise of powers conferred on him under Section 14 of the said Act vide order dated 02.11.2023 has appointed / directed the Court Commissioner to take the possession of the secured asset at the location mentioned herein below. The Court Commissioner has taken possession of the property described herein below & handed over the same to the Authorised Officer of Axis Bank Ltd., on this 13th day of June 2024.
The Borrower/Guarantors/Mortgagors attention is invited to provisions of sub section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.
The Borrower/Guarantors/Mortgagors of the properties mentioned herein above in particular and the public in general are hereby cautioned not to deal with the subject property and any dealings with the said property will be subject to the charge of the Axis Bank Ltd., for secured debts of an amount as mentioned hereinabove together with further interest at the contractual rate on the aforesaid amount and incidental expenses, costs, charges etc.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTIES
Details of Immovable Properties : Flat No A/101, on the 1st Floor, of the Building known as 'New Trinity Co-operative Housing Society Ltd.', admeasuring area 1050 square feet in City Survey No.207/B corresponding to Survey No.41, Hissa No.3, Village Valnai, Malad West, Taluka Borivali, Mumbai Suburban District, in the Registration District and Sub-District of Mumbai City and Mumbai Suburban
Type of Possession :- Physical
Date: 13 June 2024 Sd/- Authorised Officer
Place: Mumbai Axis Bank Ltd.

AXITA COTTON LIMITED
CIN: L17200GJ2013PLC076059
AXITA COTTON Registered Office: Survey No. 324 357 358, Kadi, Thol Road, Borisana, Kadi, Mahesana - 382715, Gujarat, India.
Telephone: +91-6358747514
Email: cs@axitacotton.com Website: www.axitacotton.com

NOTICE OF POSTAL BALLOT AND E-VOTING
NOTICE is hereby given pursuant to the provisions of Sections 108, 110 and other applicable provisions, if any of the Companies Act, 2013 ("the Act") read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules"), Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Secretarial Standards on General Meetings (SS-2) issued by the Institute of Company Secretaries of India, and in accordance with the requirements prescribed by the Ministry of Corporate Affairs ("the MCA") for conducting postal ballot process through e-voting, vide their circulars issued from time to time (collectively "the MCA Circulars"), the approval of Members of Axita Cotton Limited ("the Company") is being sought for the below mentioned business (detailed business have been provided in the Notice of Postal Ballot dated June 17, 2024), by way of voting by electronic means (hereinafter termed as "Remote E-Voting") by following the process of Postal Ballot and remote e-voting:

Sr. No.	Description of Resolutions	Resolution Type
1	To Approve Change in Designation of Mr. Kushal Nitinbhai Patel from Non-Executive Director to Managing Director and Approval of the Payment of Remuneration;	Special
2	To Approve Appointment of Mr. Nilesh Hasmukhbhai Kothari (DIN: 10587794) as Executive Director of the Company;	Special
3	To Approve Appointment of Ms. Shivani Rajeshbhai Pathak (DIN: 10481354) as a Non Executive Independent Director of the Company;	Special

In accordance with the General Circular Nos. 14/2020 dated 8th April, 2020, 17/2020 dated 13th April, 2020, 20/2020 dated 5th May, 2020, 22/2020 dated 15th June, 2020, 33/2020 dated 28th September, 2020, 39/2020 dated 31st December, 2020, 10/2021 dated 23rd June, 2021, 20/2021 dated 8th December, 2021, 3/2022 dated 5th May, 2022, 11/2022 dated 28th December, 2022 and 9/2023 dated 25th September, 2023 issued by the Ministry of Corporate Affairs, Government of India ("MCA Circulars"), Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular No. SEBI/HO/DDHS/P/CIR/2022/0063 dated May 13, 2022 and SEBI/HO/CRD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 issued by the Securities and Exchange Board of India ("SEBI Circular") and Secretarial Standard on General Meetings ("SS-2") issued by the Institute of Company Secretaries of India and any other applicable law, rules and regulations (including any statutory modification(s) or re-enactment(s) thereof, for the time being in force), the Notice of Postal Ballot along with explanatory statement have been sent through electronic mode only, to those Members whose names appeared in the Register of Members / List of Beneficial Owners maintained by the Company / Depositories as on Friday, June 14, 2024 ("the Cut-off Date") and whose e-mail IDs are registered with the Company / Depositories. Member may note that the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting, have been uploaded on the website of the Company at www.axitacotton.com, website of BSE Limited at www.bseindia.com, National Stock Exchange Limited website at www.nseindia.com and website of National Securities Depository Limited (NSDL) i.e. www.evoting.nsdl.com.
Further, pursuant to the MCA Circulars, the requirement of sending physical copy of the Notice, Postal Ballot forms and pre-paid business reply envelope has been dispensed with.
The members whose names appeared in the Register of Members and the Register of Beneficial Owners as on the Cut-off date are entitled to vote on the Resolution as set forth in the Notice. A person who is not a member as on the Cut-off date shall treat the Notice for information purpose only. In accordance with the MCA Circulars, the Company has provided the facility to vote on the resolutions by e-voting and for this purpose, the Company has engaged the services of National Securities Depository Limited (hereinafter referred to as "NSDL" or "Service Provider") for facilitating e-voting to enable the Members to cast their votes electronically instead of dispatching postal ballot forms. The detailed procedure and instructions for e-voting are enumerated in the Notice.
In light of the MCA Circulars, the shareholders whether holding equity shares in Demat form or physical form and who have not submitted their email addresses and in consequence to whom the Notice of Postal Ballot along with explanatory statement and instruction of e-voting could not be serviced, may temporarily get their e-mail addresses registered by following the procedure given below:
a) In case shares are held in physical mode, please provide Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by E-mail to cs@axitacotton.com
b) In case shares are held in demat mode, please provide DPID-CLID (16 digit DPID + CLID or 16 digit beneficiary ID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) to cs@axitacotton.com
c) Alternatively, shareholder/members may send a request to evoting@nsdl.co.in for procuring user id and password for e-voting by providing above mentioned documents.
The remote e-voting will commence on 09:00 A.M. on Thursday, June 20, 2024 and ends at 5:00 p.m. IST on Friday, July 19, 2024.
The remote e-voting module shall be disabled at 5:00 p.m. (IST) on Friday, July 19, 2024 and remote e-voting shall not be allowed beyond the same. During this period, the Members holding shares either in physical form or in dematerialized form, may cast their votes by e-voting.
Once the vote is cast on the resolution, the Member will not be allowed to change it subsequently or cast the vote again.
The Board has appointed M/s SCS and CO LLP, Practicing Company Secretary as a Scrutinizer ("Scrutinizer") for conducting the e-voting process in a fair and transparent manner.
The result of the postal ballot will be announced within 2 (two) working days from the conclusion of e-voting i.e. Tuesday, July 23, 2024 and communicated to the stock exchanges and will be displayed on the Company's website i.e. www.axitacotton.com.
In case of any query and/or grievance in respect of voting by electronic means, you may refer the Frequently Asked Questions (FAQs) for Shareholders and e-voting user manual for Shareholders available at the download section of www.evoting.nsdl.com/ or you can write an email to evoting@nsdl.co.in or Call us: - Tel: 1800-222-990 or Members may also contact Mr. Shyamunder Panchal, Company Secretary of the Company at the registered office of the Company or may write an e-mail to cs@axitacotton.com or may call at 6358747514 for any further clarification.
For, Axita Cotton Limited
Sd/-
Nitinbhai Govindbhai Patel
Chairman Cum Managing Director
Place: Kadi, Mahesana
Date: June 18, 2024

NOTICE-CUM-ADDENDUM

JM FINANCIAL MUTUAL FUND

FRAUDULENT SOCIAL MEDIA (WHATSAPP GROUP) ALERT
It has come to our notice that unscrupulous persons / entities are involved in luring innocent investors by creating fraudulent WhatsApp group named 'A324 (Morgan-JM Joint Profit Plan)' with JM Financial Group name, falsely claiming to offer advisory services by impersonating the employees of JM Financial Asset Management Limited ("JMFM AMC") / JM Financial Mutual Fund ("JMFM MF").
The WhatsApp Group is reportedly having more than 100 members with multiple Group Admins attached to it, with such Admin contacts fraudulently bearing photos of one of our employee with phone numbers 87972 65700 and 87972 67583 not belonging to him/her.
Apart from the aforesaid WhatsApp Group and Mobile numbers, these impostors may be using other channel(s) / platform(s) / mobile number(s) that we are not aware of.
In order to caution the public in general, we would like to inform that JMFM AMC, JMFM MF, JM Financial Trustee Company Private Limited ("JMFM TC"), employees and Directors of JMFM AMC / JMFM TC are in no way associated with these fraudulent social media accounts / posts / WhatsApp group / WhatsApp numbers and shall not accept responsibility or liability whatsoever for any loss/damages of any kind arising out of the use of or reliance on any information contained on the such WhatsApp groups, and/ or any other channel / platform which we are not aware of.
We request you to note that such WhatsApp groups are not authorized by JM Financial Group or JMFM AMC / JMFM MF / JMFM TC, nor do we operate or endorse any WhatsApp groups for advisory services.
We further request investors to be cautious of unsolicited messages claiming to offer financial advice and not to join or engage with any such Social Media / WhatsApp groups.
Further, if you come across any groups or individuals claiming to be associated with JM Financial Group or JMFM AMC / JMFM MF / JMFM TC on WhatsApp or other social media platforms, please treat them as fraudulent and report them to us immediately on Inform@jmf.com.

Place: Mumbai
Date: June 19, 2024

Authorised Signatory
JM Financial Asset Management Limited
(Investment Manager to JM Financial Mutual Fund)

For further details, please contact :
JM Financial Asset Management Limited
Registered Office: 7th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai - 400025.
Corporate Office: Office B, 8th Floor, Cnergy, Appasaheb Marathe Marg, Prabhadevi, Mumbai-400025.
Corporate Identity Number: U65991MH1994PLC078879. • Tel. No.: (022) 6198 7777
• Fax No.: (022) 6198 7704. • E-mail: investor@jmf.com • Website : www.jmfinancialmf.com

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.
REF No. 15/2024-25

Mutual Fund investments are subject to market risks, read all scheme related documents carefully.
REF No. 15/2024-25

NILKAMAL LIMITED
CIN : L25209DN1985PLC000162

Regd. Office: Survey No. 354/2 & 354/3 Near Rakholi Bridge, Silvassa-Khanvel Road, Vasona, Silvassa - 396 230 (Union Territory of Dadra & Nagar Haveli and Daman & Diu)
Phone: 0260-2699212 • Fax: 0260-2699023 Email: investor@nilkamal.com • Website: www.nilkamal.com

INFORMATION REGARDING 38th ANNUAL GENERAL MEETING TO BE HELD THROUGH VIDEO CONFERENCE ("VC")/OTHER AUDIO VISUAL MEANS ("OAVM")

Annual General Meeting:
Shareholders may note that the 38th Annual General Meeting ("AGM") of the Company will be held through VC/OAVM on Friday, July 19, 2024 at 11.00 a.m. IST, in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and Rules issued thereunder and the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with General Circular Nos. 20/2020 dated 5th May 2020, 09/2023 dated 25th September 2023 issued by the Ministry of Corporate Affairs (MCA) and Master Circular No. SEBI/HO/CFD/PoD2/CIR/P/2023/120 dated 11th July, 2023, Circular No. SEBI/HO/CFD/CFD- PoD-2/P/CIR/2023/167 dated 7th October, 2023 issued by SEBI, along with other applicable Circulars issued in this regard by the MCA and SEBI, to transact the business that will be set forth in the Notice of the AGM.
In compliance with the above Circulars, the Company will be sending electronic copies of the Notice of the AGM and Integrated Annual Report for the financial year 2023-24 to all the shareholders whose email addresses are registered with the Company/Registrar and Share Transfer Agent/Depository Participant(s) ("DP"). The Notice of the AGM and Integrated Annual Report for the financial year 2023-24 will also be made available on the Company's website at www.nilkamal.com, on the website of Stock Exchanges where the equity shares of the Company are listed, BSE Limited at www.bseindia.com, National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com.
Voting information:
The Company is pleased to provide remote e-voting facility to the Members to cast their votes electronically on all the resolutions set forth in the Notice convening the said Meeting. The facility of e-voting will also be made available at the AGM and Members attending the AGM through VC/OAVM, who have not cast their vote by remote e-voting, will be able to vote at the AGM. The Company has availed the services of NSDL to provide the facility of remote e-voting/e-voting at the AGM.
The remote e-voting period begins on Tuesday, July 16, 2024 (at 9:00 A.M. IST) and ends on Thursday, July 18, 2024, (at 05:00 PM IST). During this period shareholders of the Company, holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date Friday, July 12, 2024 may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The voting rights of Members shall be in proportion to their shares in the paid-up equity share capital of the Company as on the cut-off date i.e. Friday, July 12, 2024.
Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after sending of the Notice and holding shares as of the cut-off date, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if he/she is already registered with NSDL for remote E-voting then he/she can use his/her existing User ID and password for casting the vote.
The detailed instructions for joining the AGM through VC/OAVM and casting the vote through remote e-voting / e-voting at the AGM is provided in the Notice of AGM. Members are requested to carefully go through the same. Members, who need assistance before or during the AGM regarding e-voting facility and/or VC/OAVM facility, can send a request at evoting@nsdl.co.in or use Toll Free No.: 022-48867000/022-2499 7000.
Payment of final dividend:
Shareholders may note that the Board of Directors of the Company at their meeting held on Tuesday, May 14, 2024 have approved and recommended payment of final dividend of Rs. 20 (Rupees Twenty only) ("final dividend") per equity share of face value of Rs. 10 (Rupee Ten Only) each fully paid up for the financial year ended March 31, 2024, subject to approval of shareholders at the ensuing AGM of the Company. The final dividend, if approved, by the shareholders will be paid on or after Friday, July 26, 2024 to the shareholders whose names appears in the Register of Members or Register of Beneficial Owners, as on the close of Friday, July 12, 2024. Further, Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, July 13, 2024 to Friday, July 19, 2024 (both days inclusive) for the purpose of Annual General Meeting and dividend.
The final dividend will be paid electronically through various online transfer modes to those shareholders who have updated their bank account details. For shareholders who have not updated their bank account details, dividend warrants/demand drafts will be sent to their registered address in due course.
As shareholders may be aware, as per the Income Tax Act, 1961 ("IT Act"), as amended by the Finance Act, 2020, dividends paid or distributed by the Company after April 01, 2020, shall be taxable in the hands of the shareholders and the Company shall be required to deduct tax at source ("TDS") at the prescribed rates from the dividend, subject to approval of shareholders at the ensuing AGM. The TDS rate would vary depending on the residential status of the shareholders and the documents submitted by them and accepted by the Company.
The said information along with the detailed tax rates, exemption forms and other documents required for availing the applicable tax rates are available on the Company's website at <https://www.nilkamal.com>.
Shareholders are requested to submit the documents in accordance with the applicable provisions of the IT Act.
Registration of email and update of bank account:
Shareholders who wish to register their email address and/or update bank account mandate for receipt of dividend are requested to follow the below instructions:
a. For shares held in electronic form:
Register/Update the details in your demat account, as per the process advised by your DP; and
b. For shares held in physical form:
The shareholders are requested to note that as per the provisions of the SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-POD-1/P/CIR/2023/37 dated 16th March 2023 (subsumed as a part of SEBI Master Circular No. SEBI/HO/MIRSD/POD-1/P/CIR/2024/37 dated 7th May 2024), it is mandatory for all shareholders holding shares in physical form to furnish PAN, Choice of Nomination, Contact details (Postal Address with PIN and Mobile Number), Bank A/c details and Specimen signature for their corresponding folio numbers.
The shareholders may register/update the said details in the prescribed Form ISR-1 and other relevant forms with Link Intime India Private Limited ("Link Intime"), Registrar and Share Transfer Agent of the Company. Further, the shareholders can also access the relevant forms on the Company's website at <https://www.nilkamal.com>.
The concerned folios wherein any of the said details are not registered shall be eligible for any payment including dividend, only through electronic mode with effect from April 01, 2024. An intimation shall be sent by the Company to such shareholders whose details are not registered that their payment is due and has been withheld. Further, the same shall be released electronically only upon registering the aforesaid required details.
The above information is being issued for the information and benefit of all the shareholders of the Company and is in compliance with the applicable MCA and SEBI Circular(s). The shareholders may contact the Company's Registrar and Share Transfer Agent at Link Intime India Private Limited, C-101, 1 Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West), Mumbai-400083 Tel No: +91 8108116767 Email: mt.helpdesk@linkintime.co.in
By Order of the Board of Directors
Sd/-
Priti P. Dave
Company Secretary

FOR ADVERTISING IN TENDER PAGES
Contact
JITENDRA PATIL
Mobile No.: 9029012015
Landline No.: 67440215

Oriental Aromatics Ltd.
CIN: L17299MH1972PLC285731
Regd. Office: 133, Jehangir Building, 2nd floor, Mahatma Gandhi Road, Fort, Mumbai - 400 001.
Phone No: 022-43214000; Fax: 022-43214099
Web Site : www.orientalaromatics.com Email : investors@orientalaromatics.com

NOTICE
The notice is published pursuant to the applicable provisions of the Companies Act 2013 read with the Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 as amended ("the Rules").
The Rules, inter alia contain provisions for transfer of share(s), in the name of Investor Education and Protection Fund (IEPF) Suspend Account in respect of which dividend has not been paid or claimed for seven consecutive years or more.
Notice is further given that in accordance with the provisions of the Rules, individual notices have already been sent to respective shareholders at their latest available address in the Company records, inter alia, providing the details of shares being transferred to IEPF Suspend Account, for taking appropriate action(s). The Company has uploaded the full details of such shareholders whose shares are liable for transfer to IEPF on the website of the Company, i.e. www.orientalaromatics.com
The concerned shareholders are requested to claim the unpaid/unclaimed dividend amount(s) on or before 30th September, 2024 failing which the shares will get transferred to IEPF Suspend account. Please note that no claim shall lie against the company in respect of unclaimed dividend amount and equity shares transferred to IEPF.
Shareholders may note that both the unclaimed dividend amount and the equity share(s) transferred to the IEPF including all the benefits accruing on such shares, if any, can be claimed back by them from IEPF Authority, after following the procedure prescribed by the Rules. The Rules and the application Form (Form IEPF-5) as prescribed are available at IEPF website i.e. www.iepf.gov.in.
For any further information/clarification, shareholders are requested to write to or contact our RTA, Link Intime India Private Limited, Unit: Oriental Aromatics Limited, C-101, 247 Park, LBS Marg, Vikhroli (West), Mumbai - 400083. Tel: 022-49186270 ; Mob : +918108116767; Fax: 022-49186060; Email: mt.helpdesk@linkintime.co.in or can also contact the Nodal Officer- Ms Kiranpreet Gill at the Regd Office address of the Company.
For Oriental Aromatics Limited
Sd/-
Kiranpreet Gill
Company Secretary

PPFAS Mutual Fund
PPFAS Asset Management Private Limited
(Investment Manager to PPFAS Mutual Fund)
Registered Office: - 81/82, 8th Floor, Sakhar Bhavan, Ramnath Goenka Marg, 230 Nariman Point, Mumbai - 400 021, Maharashtra, INDIA. Tel.: 91 22 6140 6555 Fax: 91 22 6140 6590. E-mail: mt@ppfas.com. Website: www.amc.ppfas.com CIN No: - U65100MH2011PTC220623

NOTICE CUM ADDENDUM TO THE SCHEME INFORMATION DOCUMENT (SID) AND KEY INFORMATION MEMORANDUM (KIM) OF ALL SCHEMES OF PPFAS MUTUAL FUND AND STATEMENT OF ADDITIONAL INFORMATION (SAI) OF PPFAS MUTUAL FUND ("THE FUND")
Addition to the list of Official Points of Acceptance (OPA):
Investors are hereby requested to note that the company's branch office located in Ahmedabad city having address at Office No. 607, D & C Dynasty Plaza, CG Road, Near Stadium Circle, Navrangpura, Ahmedabad - 380009 shall now be considered as an Official Point of Acceptance for the transactions of the Schemes of PPFAS Mutual Fund with effect from June 19, 2024.
All other terms and conditions of the SIDs, KIMs and SAI remains unchanged.
This addendum shall form an integral part of the SID, KIM and SAI of the Fund as applicable and as amended from time to time.
For PPFAS Asset Management Private Limited
(Investment Manager to PPFAS Mutual Fund)
Sd/-
Director

Place: Mumbai
Date: June 18, 2024

MUTUAL FUND INVESTMENTS ARE SUBJECT TO MARKET RISKS, READ ALL SCHEME RELATED DOCUMENTS CAREFULLY.

PPFAS MUTUAL FUND
There's only one right way®

THE BUSINESS DAILY.

FOR DAILY BUSINESS.

FINANCIAL EXPRESS

financialexpress.com

અખ્ય સમાચારો

ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો ગુજરાત હાઈકોર્ટે મહારાજા ફિલ્મ રિલીઝ પર સ્ટે યથાવત રાખ્યો

યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા

(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ, તા. ૧૮ : મહારાજા ફિલ્મ વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટ માં થયેલી અરજી પર વધુ સુનવણી ૧૯ જૂને હાથ ધરાશે. હાઈકોર્ટમાં જજ સંગીતા વિશેનની બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં નેટફિલક્સ વતી સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી અને નવાઈન હાઈકોર્ટની કાર્યવાહીમાં જોડાયા હતા. ત્યારે યશરાજ બેનર વતી સિનિયર એડવોકેટ જાલ ઉનવાલા અને શાલીન મહેતા કોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા. જે, અદી કલાક ચાલેલી સુનાવણી દરમિયાન બંને પક્ષકારો દ્વારા દલીલો કરવામાં આવી હતી. નેટફિલક્સ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ પરનો વચગાળોને સ્ટે ટૂર કરાય, ભલે બાદમાં હાઈકોર્ટમાં સુનાવણી ચાલે, ફરિયાદીએ તેની અરજીમાં જણાવ્યું છે કે, આ ફિલ્મ બદનશી અને ધાર્મિક લાગણીઓ દુભાવનારી છે. સુપ્રીમ કોર્ટના ફૂલનેડેવી કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવ્યું છે કે ફૂલનેડેવી એક ડાકુ રાણી હતી. એમાં તેને કેટલી વખત રેપ કરાય છે એ દર્શાવ્યું છે. તે એક પછાત જાતિથી હતી. તે કેસમાં કોર્ટે કહ્યું હતું કે એક કલાકરે સમાજને દર્પણ બતાવ્યું છે. 'કાયપો છે' ફિલ્મને લગતી અરજી પરનો ડેલેબ પછ કરવામાં આવ્યો કેસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો.

યશરાજ ફિલ્મના વકીલે જણાવ્યું હતું કે, OTT માટે CBFC સર્ટિફિકેટની જરૂર નહીં. આખી ફિલ્મ સંપૂર્ણ જર્મન્ટને રજૂ કરવી નથી, કોર્ટ ફિલ્મ જોવા માંગે તો અમે તૈયાર છીએ. જર્મન્ટ ફિલ્મમાં વંચાયું નથી. ફક્ત કેસ ડિસ્મિસ કરાયો તેવું જ બતાવાયું છે. ફરિયાદી વતી સિનિયર એડવોકેટ મિહિર જોશીએ દલીલ કરતા જણાવ્યું કે, કોર્ટ ઈચ્છે ત્યારે અરજી આપી શકે, ફિલ્મ રિલીઝના આગળના દિવસે સ્ટે અપાયો તેનાથી કાયદાકીય રીતે કોઈ કેપ ના પડે. CBFC સર્ટિફિકેટ ફિલ્મને મળ્યું એટલે ફિલ્મ કાયદાકીય રીતે યોગ્ય તેમ ના કહેવાય. વળી OTT પર CBFC સર્ટિફિકેટની જરૂર નહીં તો કેમ આપ્યું? ડિ સેન્સરશિપ દ્વારા વાણીસ્વાતંત્ર્ય ઉપર રોકના લગાવી શકાય. પત્રકારો, સમાજ અને રાજકીય દૂષણ બહાર પાડે છે. ફિલ્મનું શેર ન્યુઝ પેપર કરતા પછોળું, એટલે જ તે સેન્સર થઈ શકે, ન્યુઝ મીડિયામાં ક્યાં છે? OTT ફિલ્મને અપાયેલ સર્ટિફિકેટ એટલે

રાજ્યના અંદાજિત ૨૩ લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા. ૧૮ : આજે ગાંધીનગર ખાતેથી TD (ટિટેનસ અને ડિથેરીયા) અને DPT (ટ્રિપુલ્સી) રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો હતો. જુન-જુલાઈ-ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજિત ૨૩ લાખ બાળકોનું રસીકરણ હાથ ધરાશે. આ વેક્સિન ધનુર અને ડિથેરીયા સહિતના ૧૧ પ્રકારના ઘાતક રોગો સામે પ્રતિરોધક છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું નિયુક્ત રસીકરણ અભિયાનનો મહત્તમ લાભ લઈએ

રસીકરણનો પ્રારંભ કરાવતા તેમણે ધનુર અને ડિથેરીયા ઉપરાંત ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીઓ, ઓરી, રૂબેલા, ન્યુમોનિયા અને મગજના તાવ જેવા ઘાતક રોગો સામે પ્રતિરોધક આ રસીનો રાજ્યના મહત્તમ બાળકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વધુ વિગતો આપતા તેમણે કહ્યું કે, આ વર્ષે જુન-જુલાઈ અને ઓગષ્ટ મહિના દરમિયાન રાજ્યના અંદાજિત ૨૩ લાખ બાળકોને ઉક્ત રસીકરણ અભિયાન અંતર્ગત રોગ પ્રતિરોધક રસી આપવામાં આવશે. રાજ્યની

જામનગરમાં ખાનગી શાળામાં ચાલુ શાળાએ આગ લાગી

(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગર, તા. ૧૮ : જામનગરમાં સરસેક્સન રોડ પર આવેલી ખાનગી મોડર્ન સ્કૂલ કે જેમાં સવારની શિક્ષકાનાં અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે તેમ દરમિયાન સ્કૂલના પાછળના ભાગમાં સવારે સોર્ટસાઈટ થવાના કારણે આગ લાગી હતી. જેથી ભારે અકરાતકરીનો માહોલ સર્જાયો હતો. શાળા સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જ્યારે મહાનગર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજવી દેતાં સર્વે એ હાથકારો અનુભવ્યો હતો.

જામનગરમાં સરસેક્સન રોડ પર આવેલી ખાનગી મોડર્ન સ્કૂલ કે જેમાં સવારની શિક્ષકાનાં અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે તેમ દરમિયાન સ્કૂલના પાછળના ભાગમાં સવારે સોર્ટસાઈટ થવાના કારણે આગ લાગી હતી. જેની જામનગર મહાનગર નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. ટુકડી તુરંત જ સ્થળ પર પહોંચે તે પહેલા શાળા સંચાલકો દ્વારા યુદ્ધના ધોરણે તમામ બાળકોને તેઓના કલાસરૂમમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા.

ફાયર બ્રિગેડ શાખાના ભરત ગોહેલ તેમજ ભારત જેઠવા સહિત ચાર જેટલા ફાયરના જવાનોની ટીમ દ્વારા શાળામાં જ લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરી તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલમાં લાગેલી આગ બુઝવી દેવામાં આવી હતી, જેથી સર્વે એ હાથકારો અનુભવ્યો હતો. સ્થિતિ થાળે પડતાં મોડેથી શાળામાં શૈક્ષણિક કાર્યની કાર્યવાહી પૂનઃ શરૂ કરી દેવામાં આવી હતી.

તમામ વિદ્યાર્થીના વાલીઓમાં પ્રશ્ન થોડો સમય માટે ચિતાનું મોજું પ્રસરી ગયું હતું, પરંતુ આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી સર્વે એ હાથકારો અનુભવ્યો હતો.

PUBLIC NOTICE FOR LOSS OF SALE DEED
Notice is hereby given to the public that the Original Sale Deed Bearing No. 552 dated 09/03/2004, executed between ALFA PHOTO MARKETING PRIVATE LIMITED therein called the Vendor of the One Part and myself on the Other Part, I namely SAMIR K. CHOKSI purchased an immovable property situated at Gala bearing no. 30 admeasuring (1182 Sq.Ft.) 109.80 Sq.Mtrs Build Up areas on the Ground Floor of Building Known as "TIRUPATI INDUSTRIAL ESTATE" laying and being at village Amli in the registration Sub-District of Silvassa in the U.T of DNH and bearing survey no. 113/2/1. Has been lost/misplaced. All person are hereby informed that not to carry on any transaction on the basis of said missing document. On behalf of the client, Namely Samir K. Choksi, the undersigned advocate hereby invites calims or objections, if any, for the transfer of said Gala Bearing No. 30. In case of any claims/objection kindly intimate the undersigned advocate along with relevant documents to support their claims/objections within 14 days from the date of publication of this notice. In absence of any claim within stipulated period, it shall be deemed that the property has no claim by virtue of lost of sale deed.

Date : 18/06/2024
Place : Silvassa
Adv. Priyank D. Jadav
R/o. Off. Vrundavan House
UNDER OUR INSTRUCTIONS
No. 632, School Faliya,
Kharadpada, Silvassa,
U.T of DNH and D&D.
Samir K. Choksi

No. BBA-Poly-NEUT/2024-25/102
Date: 15/06/2024
ADVERTISEMENT CSAB NEUT 2024

The Principal of Dr. B.B.A. Government Polytechnic, Karad, (Silvassa), U.T. Administration of Dadra and Nagar Haveli & Daman and Diu. Advertisement of CSAB NEUT 2024 for Professional Courses of B.E. and B. Pharmacy allotted by Government of India for Students of Dadra and Nagar Haveli: 2024-25. The details of advertisement will be available on official website www.ddd.gov.in and www.dnh.gov.in
Start date: - 17/06/2024
End date: - 24/06/2024

NO. IP/DMN/25/2024-25/367 DATED : 17/06/2024

CHANGE OF NAME
I HAVE CHANGED OLD NAME FROM JAYSUKH NARAYANBHAI BHANDARI TO NEW NAME JAYSUKH NARANBHAI BHANDARI, & I WILL BE KNOWN AS NEW NAME WHICH PLEASE NOTE.
SD: JAYSUKH NARANBHAI BHANDARI,
ADDRESS: 2130/47,
F.No.205, Golden park "B",
Dunetha, Nani Daman,
Daman & Diu-396210- India

CHANGE OF NAME
OLD NAME: CHAUHAN DEEPIKA ATABER
NEW NAME: DEEIPKA ATIVR SINGH CHAUHAN.
ADDRESS: FLAT NO. 605, 6TH FLOOR, A BUILDING, PARAM RESIDENCY, NEAR KACHIGAM CHECK POST, KACHIGAM, NANI DAMAN, DAMAN- 396 210.

જૈવિક (ઓર્ગેનિક) ખાદ્ય ચીજોનો ખોરાકમાં ઉપયોગ કરો અને રોગમુક્ત રહો.
અમારે ત્યાં કાચી ઘાણીના સીંગેલ, ચમનુ તેલ, તલનુ તેલ, સુર્યમુખી તેલ, કોપરાનુ તેલ વિ. (તેલીબિયાની ઉપલબ્ધી ને આધારે) મળે છે. એ સિવાય ઘઉં, મરચુ, ઘાણા-જીરુ પાવર, હિંગ, મધ, ગોળ અને અન્ય આખા મસાલા, ફોળ અને જાણીના સાલુ પણ મળશે.
અતુલ વલસાડ રોડ, પારનેરા હિલ્સ સોસાયટી સામે, કટારિયા (મારંતે શો રસ્તાની બાજુમાં) પારનેરા. મો.: 9978206333

UT ADMINISTRATION OF DADRA & NAGAR HAVELI AND DAMAN & DIU
Dept. of Animal Husbandry & Veterinary Services
TENDER NOTICE
Purchase of Dry Grass for Govt. Dairy Demonstration Farm, Dokmardi-Amli

Tender No. : 2024_DAMAN_3533_1
Publish Date : 11/06/2024
Doc. Down/Sale start date : 11/06/2024 5.00 PM
Doc. Down/Sale end date : 01/07/2024 5.00 PM
Bid submission start date : 11/06/2024 5.30 PM
Bid submission end date : 01/07/2024 5.30 PM
Bid opening date : 02/07/2024 11.00AM

ic Director cum Joint Secretary (AHVS), DNH & DD, PWD Capus, Bld-4, Silvassa.
NO. IP/DMN/25/2024-25/368 DATED : 17/06/2024

NOTICE INVITING TENDER
Name of work :- "Providing RCC Pipe line for disposal of proper Drainage at Samarvani Rakholi road.(2" Call)."

Tender Notice No. :- 04 of 2024-25
On line downloading start of tender documents :- 17.06.2024 18.00 Hrs
Pre Bid Meeting :-
Last date & Time for Receipt of Bid/Uploading Bid :- 24.06.2024 12.00 Hrs
Online Opening of Technical Bid :- 24.06.2024 15.30 Hrs
On line opening of Price Bid :- 24.06.2024 18.00 hrs. (if possible)

For details please scan dnhenders.gov.in or road-dnh.nic.in
0260 2642041
Tender ID No. : 2024_UTDNH_7999_1
Outward No. :- 3-21(18)PWD/J/Road/274 dt:17.06.2024
NO. IP/DMN/25/2024-25/369 DATED : 18/06/2024

CHANGE OF NAME
OLD NAME: CHAUHAN DEEPIKA ATABER
NEW NAME: DEEIPKA ATIVR SINGH CHAUHAN.
ADDRESS: FLAT NO. 605, 6TH FLOOR, A BUILDING, PARAM RESIDENCY, NEAR KACHIGAM CHECK POST, KACHIGAM, NANI DAMAN, DAMAN- 396 210.

દામણગંગા ટાઇમ્સ ઈ-પેપર ડાઉનલોડ કરવા માટે કડચુઆર લોડ સ્ટેન કરો

લગ્ન સિઝન નિમિત્તે સ્પે. ધમાકા સેલ
લેડીઝ વેરાયટી
કેન્સી ચંપલ, કેન્સી મોજડી
ફક્ત Rs. 300
જેન્ટસ સ્પોર્ટ શુઝ વેરાયટી
ફક્ત Rs. 300
પુરા ફેમીલી માટે માટે અપનવી ફેન્સી વેરાયટીનો અખુટ ખજાનો
અમારે ત્યાં જેન્ટસ, લેડીઝ અને ચિલ્ડ્રન માટે ખ્યાત નામ કંપનીઓની ઓલ સિઝન ફેન્સી વેરાયટીઓ મળશે.
કાપડીયા કોમ્પ્લેક્સ, હાઈવેજ સામે, બેચર રોડ, અમારી બીજી કોઈ શાખા નથી વલસાડ. મો. : 8690820403

લગ્ન પ્રસંગ નિમિત્તે
ફેન્સી વેરાયટીનો અખુટ ખજાનો
પાર્ટી શુઝ
લોફર શુઝ
સ્પોર્ટ શુઝ
ઓલ સીઝન ચંપલ, સેનલ, લાઈટ શુઝ, સેફ્ટી શુઝ, લાઈટ વાળા શુઝ
MAYUR FOOTWEAR
ADDA vkco pride spax RELAXO
Jaraqoj Bata Lakhani campus
શાકભાજી માર્કેટ, જ્યોતિ હોલ નીચે, વલસાડ. મો. 9824254361

Jai Jalaram Bapa
Septic Tank Cleaner
ખાળ કુવાની સફાઈ
ખાર કુવે કી સફાઈ
TANKER CAPACITY 8000 LITER
WATER JETTING, AIR BLOWING, VACUUMING
પાણીના પ્રેશરથી હવા મારીને ટાંકી સાફ કરી આપવામાં આવશે.
આધુનીક મશિનરી થી કામ કરી આપવામાં આવશે.
Contact: 99046 44348, 98247 28200

દરેક બ્રાન્ડેડ કંપનીના શુટીંગ, શર્ટીંગ તથા લેટેસ્ટ ડીઝાઈનમાં ટેલરીંગ શુટ સિવાયો કાપડ તથા સીલાઈ સાથે રૂ. 5000/-
The Complete Man raymond
dinesh
Siyarams
DONENAR
DIGJAM
NIRVAN SHIRTINGS
ICON ashima LUXURY FABRICS
Kiplon
LORDS MEN'S WEAR
એમ. જી. રોડ, વલસાડ. ફોન : ૨૪૮૧૭૭